

JH-103

June-2022

B.Sc., Sem.-II**103 : Mathematics****(Differential Equations & Co-ordinate Geometry)****Time : 2 Hours]****[Max. Marks : 50**

- સૂચનાઓ :**
- (1) Section – Iના દરેક પ્રશ્નના ગુણ સમાન છે.
 - (2) Section – Iમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના છે.
 - (3) Section – IIનો પ્રશ્ન નં. 9 ફરજીયાત છે.

SECTION – I

1. (A) બર્નોલીનું વિકલ સમીકરણ લાગો અને તેના ઉકેલની રીત સમજાવો. 7

(B) સમીકરણ ઉકેલો : 7

$$(i) (\sin y - \cos x) dx + (x \cos y + \sin y) dy = 0$$

$$(ii) x \frac{dy}{dx} + y = x^3 y^4$$

2. (A) કલેરોટનું વિકલ સમીકરણ લાગો તથા તેના ઉકેલની રીત વાર્ણવો. 7

$$\text{વધુમાં } p^2 - 3p + 2 = 0 \text{ નો ઉકેલ પણ મેળવો, જ્યાં } p = \frac{dy}{dx}. 7$$

(B) સમીકરણ ઉકેલો : 7

$$(i) xyp^3 + (2y^2 - 3x^2)p^2 - 6xyp = 0; \text{ જ્યાં } p = \frac{dy}{dx}$$

$$(ii) y = 2p + 3p^2; \text{ જ્યાં } p = \frac{dy}{dx}$$

3. (A) જો $f(-a^2) \neq 0$ હોય, તો સાબિત કરો કે : $\frac{1}{f(D^2)} \sin ax = \frac{1}{f(-a^2)} \sin ax$; જ્યાં $D = \frac{d}{dx}$.

વધુમાં $\frac{1}{D^3 + D^2 + D + 1} \sin 2x$ નું સાદું રૂપ આપો.

7

(B) સમીકરણ ઉકેલો :

7

$$(i) (D^4 - 6D^3 + 11D^2 - 6D)y = 0$$

$$(ii) (D^2 - D - 6)y = 2e^{2x} - 5$$

4. (A) જો $f(D + a) \neq 0$ હોય, તો સાબિત કરો કે : $\frac{1}{f(D)} e^{ax} V = e^{ax} \frac{1}{f(D+a)} V$; જ્યાં V -ચલ x નું

વિધેય છે.

7

(B) સમીકરણ ઉકેલો :

7

$$(i) (D^2 + 9)y = \sin 3x$$

$$(ii) (x^2 D^2 - x D + 1)y = 2 \log x$$

5. (A) સમતલ $lx + my + nz = p$, $p \neq 0$ ગોલક $x^2 + y^2 + z^2 = a^2$ ને સ્પર્શી તે માટેની શરત તથા સ્પર્શબિંદુના યામ મેળવો.

7

(B) સાબિત કરો કે :

$$\text{ગોલકો } x^2 + y^2 + z^2 - 6x - 4y - 10z + 2 = 0 \text{ અને } x^2 + y^2 + z^2 - 2x - 2y - 6z + 2 = 0$$

પરસ્પર અંદરથી સ્પર્શી છે. સ્પર્શબિંદુના યામ પણ શોધો.

7

6. (A) R^3 ના બે બિન્ન ગોલકો લંબચલેદી હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત મેળવો. જો બે ગોલકો $x^2 + y^2 + z^2 - kx + 4y + 3 = 0$ અને $x^2 + y^2 + z^2 + 4x + 6y + kz + 5 = 0$ લંબચલેદી હોય, તો 'k' ની કિંમત શોધો.

7

$$(B) વર્તુળ $x^2 + y^2 + z^2 - 2y + 2z - 23 = 0$; $x + 2y - 2z + 5 = 0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.$$

7

7. (A) પ્રયત્નિત સંકેતમાં શાંકવનું ધ્રુવીય સમીકરણ $\frac{1}{r} = 1 + e \cos \theta$ મેળવો. 7

(B) જો R^3 માં બિંદુ A ના ગોલીય ચામ $\left(2, \frac{\pi}{4}, \frac{\pi}{6}\right)$ હોય, તો તેના કાર્તેજીય અને નળાકારીય ચામ મેળવો. 7

8. (A) સાબિત કરો કે સમીકરણ $x^2 + y^2 + z^2 - 16xy - 16yz + 16zx = 0$ સમશંકુ દર્શાવી છે. તેનો અક્ષ અને અર્ધ શીરઃકોણ મેળવો. 7

(B) $Z -$ અક્ષને સમાંતર સર્જક રેખાવાળા નળાકારનો આધારવટ $x^2 + y^2 + z^2 = 8, x + 2y + 2z = 6$ હોય, તો તે નળાકારનું સમીકરણ મેળવો. 7

SECTION – II

9. ટૂકમાં જવાબ આપો (ગમે તે ચાર) : 8

(1) વિકલ સમીકરણ $\left[1 + \left(\frac{dy}{dx}\right)^3\right]^{\frac{4}{3}} = \frac{d^3y}{dx^3}$ ની કક્ષા અને પરિમાણ લખો.

(2) વિકલ સમીકરણ $e^{y-xp} = 2p + p^2$ નો સામાન્ય ઉકલ મેળવો.

(3) સાહું ઇપ આપો : $\frac{1}{D^2 - 1} x^3.$

(4) R^2 માં $(1, -\sqrt{3})$ કાર્તેજીય ચામવાળા બિંદુના ધ્રુવીય ચામ શોધો.

- (5) ગોલક $x^2 + y^2 + z^2 - 2x + 2y - 2z - 6 = 0$ પરના (0, 1, -1) બિંદુએ સ્પર્શતલનું સમીકરણ મેળવો.
- (6) ઉદ્ગમબિંદુ શિરોબિંદુ, Y – અક્ષ પોતે જ સમશંકુનો અક્ષ અને θ અર્ધ શીર્ષકોણવાળા સમશંકુનું સમીકરણ લખો.
-

JH-103**June-2022****B.Sc., Sem.-II****103 : Mathematics****(Differential Equations & Co-ordinate Geometry)****Time : 2 Hours]****[Max. Marks : 50**

- Instructions :**
- (1) Each question in Section – I carry equal marks.
 - (2) Attempt any **Three** questions in Section – I.
 - (3) Question – **9** in Section – II is Compulsory.

SECTION – I

1. (A) Write Bernoulli's differential equation and explain the method of its solution. **7**
 (B) Solve the equations : **7**
 - (i) $(\sin y - \cos x) dx + (x \cos y + \sin y) dy = 0$
 - (ii) $x \frac{dy}{dx} + y = x^3 y^4$

2. (A) Write Clairout's differential equation and explain the method of its solution. Also solve $p^2 - 3p + 2 = 0$, where $p = \frac{dy}{dx}$. **7**
 (B) Solve the equations : **7**
 - (i) $xyp^3 + (2y^2 - 3x^2)p^2 - 6xyp = 0$; where $p = \frac{dy}{dx}$
 - (ii) $y = 2p + 3p^2$; where $p = \frac{dy}{dx}$

3. (A) If $f(-a^2) \neq 0$ then prove that $\frac{1}{f(D^2)} \sin ax = \frac{1}{f(-a^2)} \sin ax$; where $D = \frac{d}{dx}$. Also

$$\text{simplify } \frac{1}{D^3 + D^2 + D + 1} \sin 2x.$$

7

(B) Solve the equations :

7

$$(i) \quad (D^4 - 6D^3 + 11D^2 - 6D)y = 0$$

$$(ii) \quad (D^2 - D - 6)y = 2e^{2x} - 5$$

4. (A) If $f(D + a) \neq 0$ then prove that : $\frac{1}{f(D)} e^{ax} V = e^{ax} \frac{1}{f(D+a)} V$; where V is function of variable x .

7

(B) Solve the equations :

7

$$(i) \quad (D^2 + 9)y = \sin 3x$$

$$(ii) \quad (x^2 D^2 - xD + 1)y = 2 \log x$$

5. (A) Find the condition that the plane $lx + my + nz = p$, $p \neq 0$ touches the sphere $x^2 + y^2 + z^2 = a^2$. Also obtain the co-ordinates of the point of contact.

7

(B) Prove that the spheres $x^2 + y^2 + z^2 - 6x - 4y - 10z + 2 = 0$ and

$x^2 + y^2 + z^2 - 2x - 2y - 6z + 2 = 0$ touch each other internally. Also obtain the co-ordinates of the point of contact.

7

6. (A) Obtain the necessary and sufficient condition for two different spheres in R^3 are orthogonal. If two spheres $x^2 + y^2 + z^2 - kx + 4y + 3 = 0$ and $x^2 + y^2 + z^2 + 4x + 6y + kz + 5 = 0$ are orthogonal then find value of 'k'.

7

(B) Find the centre and radius of the circle :

7

$$x^2 + y^2 + z^2 - 2y + 2z - 23 = 0; x + 2y - 2z + 5 = 0$$

7. (A) In usual notation obtain the polar equation of a conic $\frac{1}{r} = 1 + e \cos \theta$.

7

(B) If the spherical co-ordinates of point A are $\left(2, \frac{\pi}{4}, \frac{\pi}{6}\right)$ in R^3 , find its Cartesian and Cylindrical co-ordinates.

7

8. (A) Prove that the equation $x^2 + y^2 + z^2 - 16xy - 16yz + 16zx = 0$ represents a right circular cone. Find its axis and semi-vertical angle. 7
- (B) Find the equation of the cylinder whose generator line parallel to Z-axis and the guiding curve is $x^2 + y^2 + z^2 = 8$; $x + 2y + 2z = 6$. 7

SECTION – II

9. Give the answer in short (Any **Four**) : 8

(1) Write the order and degree of the differential equation :

$$\left[1 + \left(\frac{dy}{dx} \right)^3 \right]^{\frac{4}{3}} = \frac{d^3y}{dx^3}$$

(2) Obtain the general solution of differential equation $e^{y-xp} = 2p + p^2$.

(3) Simplify : $\frac{1}{D^2 - 1} x^3$.

(4) Find out the polar co-ordinates of the point having Cartesian co-ordinate $(1, -\sqrt{3})$ in R^2 .

(5) Find the equation of tangent plane to the sphere

$$x^2 + y^2 + z^2 - 2x + 2y - 2z - 6 = 0 \text{ at point } (0, 1, -1) \text{ on it.}$$

(6) Write an equation of a right circular cone, whose vertex is origin, axis is Y-axis and semi-vertical angle is θ .

